

જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩
કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૧૨/૦૪/૨૦૧૮ ગુરુવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૭૦૪/૧૮

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૬૪ કેસ કરી, ૫૨ વ્યક્તિઓને ઝડપી, ૩૩૨ લીટર દેશી દારૂ, ૧૬૩ બોટલ ઈંગ્લીશ દારૂ, ૩૪ ક્વોર્ટર ઈંગ્લીશ દારૂ, ૦૧ બિયર ટીન, ૧૦ બીયર બોટલ, ૦૧ મોટર સાયકલ, ૦૧ સ્કુટર અને ૦૧ કાર કબજે કરી હતી. તેમજ જુગાર ધારા હેઠળ ૦૮ કેસ કરી ૩૬ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૫૬,૪૭૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૭૦૫/૧૮

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૨૩૩ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રો.હી.૯૩ મુજબ ૧૦ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

વિશ્વાસઘાત અને છેતરપીંડી :-

સમાચાર યાદી નં.૭૦૬/૧૮

ઇસનપુર : અશોકભાઈ છગનભાઈ પટેલ (રહે,ન્યુ રાધિકા સોસાયટી, ચંડોળા તળાવ ઢાળ ઉતરતાં ઇસનપુર) એ તા.૧૧/૪/૧૮ નારોજ ઇસનપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૫/૦૨/૧૮ થી તા.૧૬/૨/૧૮ બપોરના ૨/૦૦ સુધીના સમયગાળા દરમ્યાન આરોપી સતીષભાઈ સુરેશભાઈ પિલ્લઈ (રહે, માણી ફ્લોરા ફ્લેટ, સીધવાઈ માતાજી મંદિર પાસે, સી.ટી.એમ. ચાર રસ્તા) તથા બીજા બે માણસો (જેના નામ-ઠામ જણાવેલ નથી) ભેગામળી અશોકભાઈને વિશ્વાસમાં લઈ, બીજા માણસની ડસ્ટર ગાડી નંબર જી.૨૭.એ.પી.૮૧૨૨ રૂપિયા ૩,૨૦,૦૦૦/- માં અશોકભાઈને વેચાણ આપી, ગાડીના પુરા રૂપિયા ચુકવેલ હોવા છતાં આરોપીઓ ભેગામળી અશોકભાઈના ઘરે આવી, તેમની સંમતિ વગર ડ્રાઈવિંગ યાદી થી ગાડી ચાલુ કરી લઈ જઈ અશોકભાઈ સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એન.જી.મારુ ચલાવે છે.

ચોરી :-

સમાચાર યાદી નં.૭૦૭/૧૮

સાબરમતી : ભરતકુમાર જ્યંતીલાલ સોની (ઉ.વ.૬૪)(રહે,રાધે બંગ્લોઝ, વિભાગ-૧ એરોન કોમ્પ્લેક્ષ સામે ચાંદખેડા) એ તા.૧૧/૪/૧૮ નારોજ સાબરમતી પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૫/૦૪/૧૮ બપોરના ૩/૪૫ થી ૪/૦૦ વાગ્યા દરમ્યાન સાબરમતી રામનગર ચોકમાં આવેલ વરણી જવેલર્સ નામની પોતાની દુકાન માં એક અજાણી બહેન (૩૮ થી ૪૦ વર્ષના આશરેની) ભરતકુમારની નજર ચુકવી સોનાની ચેઈન કિંમત રૂપિયા ૬૦,૦૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી બી.પી મેઘલાધર ચલાવે છે.

વાહન ચોરી :-

સમાચાર યાદી નં.૭૦૮/૧૮

નારણપુરા : મિતુલ સ/ઓ વિરેન્દ્રભાઈ રમણલાલ પારેખ(સોની) (રહે,સરદાર પટેલ કોલોની સરદાર પટેલ બાવલા પાસે નારણપુરા) એ નારણપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૧/૦૪/૧૮ ના કલાક ૦૦/૧૫ થી ૩/૪૫ વાગ્યા દરમ્યાન પોતાના ઘર નજીક પાર્કિંગમાં પોતાની મારૂતિ સીયાઝ કાર નંબર જીજી.૦૧.આર.એસ.૩૨૯૩ કિંમત રૂપિયા ૭,૦૦,૦૦૦/- પાર્ક કરી મુકી હતી. જેની કોઈ અજાણી વ્યક્તિ ચોરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી ડી.એન.પરમાર ચલાવે છે.

નવરંગપુરા : જયગીરી ધર્મેન્દ્રગીરી ગૌસ્વામી (રહે,વિજગંગા બંગલો હીંગળાજ માતાની ચાલી નવરંગપુરા ગામ) એ તા.૧૧/૪/૧૮ નારોજ નવરંગપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૬/૦૩/૧૮ રાતના ૧૨/૦૦ વાગ્યાના સુમારે અવની કોમ્પ્લેક્ષની સામે આવેલ ગાર્ડનની બાજુમા રોડ ઉપર પોતાની સેન્દ્રો કાર નંબર જીજી.૦૧.એચ.ક્યુ.૫૪૭૨ કિંમત રૂપિયા ૧,૦૦,૦૦૦/- પાર્ક કરી મુકી હતી. જેની કોઈ અજાણી વ્યક્તિ ચોરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી યુ.જી.જોષી ચલાવે છે.

વીજ કરંટ લાગતાં મૃત્યુ:-

સમાચાર યાદી નં.૭૦૯/૧૮

સરખેજ : પ્રકાશ સ/ઓ કલાજી સાકરીયા (બામણીયા)(ઉ.વ.૧૯)(રહે,કાઈલ-૨ એપલવુડ ની સામે શાંતીપુરા સર્કલ પાસે સરખેજ તા.૧૧/૦૪/૧૮ સાંજના ૫/૦૦ વાગ્યાના સુમારે સરખેજ શાંતીપુરા સર્કલ પાસે એપલવુડ ની સામે કાઈલ-૨ ખાતે દિવાલનું ચણતર કામ કરતા હતા દરમ્યાન પાલક ઉપરથી પગ લપસી પડતા, ડાબા હાથે ઈલેક્ટ્રીક વાયર પકડી લેતા, કરંટ લાગતા નીચે પડી જતા, સારવાર અર્થે તેમને સહયોગ હોસ્પિટલ ખાતે લઈ જતા, ફરજ પરના ડૉ.શ્રી સાંજનાં ૬/૦૦ વાગે તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે સરખેજ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મ.સ.ઇ.શ્રી એમ.એલ.રામાણી ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૭૧૦/૧૮

વેજલપુર : વિનોદભાઈ કાળીદાસ વૈષ્ણવ (રહે,મનમંદીર રો-હાઉસ ગોકુલધામ ફ્લેટ પાસે વેજલપુર) એ બીમારીથી કંટાળી જઈ તા.૧૧/૦૪/૧૮ ના કલાક ૦૦/૦૦ થી સવારના ૯/૦૦ વાગ્યા દરમ્યાન કોઈપણ સમયે પોતાના ઘરે છતના હુક સાથે દોરી બાંધી ગળેફંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે વેજલપુર પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી પ્રભાતસિંહ જવાનસિંહ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.